



CAPTAIN PIPES LTD.

Regd. Office & Works : Survey No. 257, Plot No. 23 to 28, N.H. No. 27, SHAPAR (Veraval)
Dist. Rajkot (Gujarat) INDIA. Mobile : +91 99090 29066, Toll Free Number : 1800 212 5626
website : www.captainpipes.com | e-mail : info@captainpipes.com
CIN : L25191GJ2010PLC059094

DATE : 03/05/2025

To,

The Bombay Stock Exchange (BSE Limited)
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai- 400001

Dear Sir / Madam,

Sub: NEWSPAPER PULICATION OF BOARD MEETING NOTICE

Pursuant to the requirement of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, attached herewith newspaper publication of board meeting notice given in Financial Express Newspaper One Vernacular Language(Gujarati) dated 01/05/2025 And Other Nationwide Circulating English Newspaper dated 01/05/2025.

Kindly take note of the above.

Thanking you,

Yours faithfully,

FOR, CAPTAIN PIPES LIMITED

Kantilal
Manilal Gediya



**KANTILAL M. GEDIA
(WHOLETIME DIRECTOR)
DIN: 00127949**

captainCAPTAIN PIPES LTD.
Email: account@captainpipes.com
Website: www.captainpipes.com
CIN No.: L25191GJ2010PLC050904**NOTICE**

Pursuant to regulation 29 of the SEBI LODR Regulations 2015, Notice is hereby given that the meeting of board of directors of the company will be held on Saturday, 10th May 2025.

To consider and approve the audited financial results for the quarter and the year ended on 31st March, 2025.

The said notice can be accessed on the website of the company at www.captainpipes.com and may also be accessed on the stock exchange website at www.bseindia.com.

Place: Rajkot

Date: 30/04/2025

For, Captain Pipes Ltd
sd/
Gopal Khichadi
(Managing Director)**captain**CAPTAIN POLYPLAST LTD.
e-mail: info@captainpolyplast.in
web: www.captainpolyplast.in
CIN No.: L25209GJ1997PLC031985**NOTICE**

Notice is hereby given that pursuant to regulation 29 of the SEBI LODR Regulations 2015, the meeting of board of directors of the company will be held on Saturday, 10th May 2025.

To consider the standalone & consolidated audited financial results for the quarter and year ended on 31st March, 2025.

The said notice can be accessed on the website of the company at www.captainpolyplast.com and may also be accessed on the stock exchange website at www.bseindia.com.

Place: Rajkot

Date: 30/04/2025

For, Captain Polyplast Ltd

sd/
Khyati Mehta
(Company Secretary)**UJJIVAN**
UJJIVAN SMALL FINANCE BANKUjjivan Small Finance Bank Limited
Registered Office and Head Office: Group Garden, No. 27, 3rd 'A' Cross, 18th Main, 6th Block, Koramangla, Bengaluru-560095, Karnataka, India. Tel: +91 80 4971 2121
Website: www.ujjivan.in; E-mail: investorrelations@ujjivan.com
Corporate Meeting Number: L55119KZ01992PLC016102**Statement of Financial Results for the Quarter and Financial Year ended March 31, 2025** (₹ in Lakhs)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		March 31, 2024	March 31, 2025	March 31, 2024	March 31, 2025
		Audited	Unaudited	Audited	Audited
1.	Total Income from Operations	1,76,464	1,76,324	1,84,305	6,46,391
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	43,956	13,637	9,526	1,70,217
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	43,956	13,637	9,526	1,70,217
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	32,963	10,862	8,339	1,28,150
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-	-	-	-
6.	Share Capital	1,93,143	1,93,454	1,93,500	1,93,500
7.	Reserves (including Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	2,05,440	3,68,206	3,68,206	2,05,440
8.	Earnings per Share (EPS)				
1. Basic (₹)	1.67	0.56	0.43	6.65	3.75
2. Diluted (₹)	1.71	0.56	0.43	6.54	3.71

Notes:

1. The above results were reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their meeting held on April 30, 2025.
2. The audit under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been carried out by the Statutory Auditors. An unqualified report has been issued by them thereon.
3. The information related to the total comprehensive income and other comprehensive income has not been furnished as IAS 1 is not yet made applicable to the Bank.
4. The Bank has followed the same significant accounting policies in the preparation of these financial results as those followed in the annual financial statements for the year ended March 31, 2024.

5. The above is an extract of the detailed format of annual financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter and financial year ended March 31, 2025 is available on the Stock Exchanges websites www.nseindia.com and www.bseindia.com and also on the Bank's website at www.ujjivan.in.



For and on behalf of the Board of Directors of UJJIVAN SMALL FINANCE BANK LIMITED
sd/
Sangeeta Nayyar
Managing Director and CEO
DIN: 08075972

Place: Bengaluru
Date: April 30, 2025**इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड**
Indian Oil Corporation Limited[CIN - L23201MH1959GOI011388]
Regd. Office: Indian Oil Bhavan, G-9, A-8 Yaver Jung Marg, Bandra (East), Mumbai-400 051
Website: www.iocl.com Email ID: investors@indianoil.in**Innovation Led Sustainable Transformation****STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH 2025** (₹ in Crore)

Sl. No.	PARTICULARS	STANDALONE				CONSOLIDATED			
		AUDITED RESULTS FOR THE QUARTER ENDED	UNAUDITED	AUDITED	AUDITED RESULTS FOR THE YEAR ENDED	AUDITED RESULTS FOR THE QUARTER ENDED	UNAUDITED	AUDITED	AUDITED RESULTS FOR THE YEAR ENDED
		31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025
1.	Revenue from Operations	2,17,725.44	2,16,849.47	2,19,875.55	8,45,512.61	8,86,345.38	2,21,360.24	2,19,522.35	8,59,362.73
2.	Other Income	2,172.42	1,881.73	1,656.98	4,963.84	4,730.89	1,237.84	1,021.57	1,449.29
3.	Total Income	2,18,898.86	2,18,731.20	2,21,532.53	8,50,476.45	8,91,076.27	2,22,598.08	2,20,543.92	8,60,732.02
4.	Total Expenses	2,10,113.19	2,15,740.79	2,15,200.23	8,36,432.13	8,18,781.99	2,12,834.10	2,18,691.61	8,49,411.46
5.	Net Profit/(Loss) for the period before Share of Profit/(Loss) of Associates and Joint Ventures, Exceptional Items and Tax	8,785.67	2,990.41	6,332.30	14,044.32	52,344.21	9,763.96	1,852.31	1,183.10
6.	Share of Profit/(Loss) of Associates and Joint Ventures	-	-	-	-	276.62	234.49	236.54	1,760.43
7.	Net Profit/(Loss) for the period before Extraordinary Items and Tax	8,785.67	2,990.41	6,332.30	14,044.32	52,344.21	10,043.89	2,088.80	15,225.43
8.	Net Profit/(Loss) for the period before Tax	8,786.72	3,470.88	6,332.30	15,882.34	52,344.21	10,044.85	2,768.47	17,863.45
9.	Net Profit/(Loss) for the period after Tax	7,264.85	2,873.53	4,837.69	12,961.57	39,618.84	8,367.63	2,147.35	14,587.92
10.	Net Profit/(Loss) for the period after Tax attributable to Equityholders of the Parent	8,123.64	2,115.29	5,148.87	11,602.16	52,975.06	10,350.29	(5,010.06)	12,251.58
11.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	8,233.37	(3,834.60)	11,570.82	11,602.16	52,975.06	10,350.29	(5,010.06)	12,251.58
12.	Total Comprehensive Income for the period attributable to Equityholders of the Parent	-	-	-	-	-	10,108.21	(5,053.86)	11,886.60
13.	Share of Profit/(Loss) of Associates and Joint Ventures	14,121.24	14,121.24	14,121.24	14,121.24	14,121.24	14,121.24	14,121.24	14,121.24
14.	Other Equity excluding Revaluation Reserves	-	-	-	1,64,905.30	1,62,943.42	-	-	1,72,715.76
15.	Securities Premium Account	-	-	-	-	79.94	79.94	79.94	79.94
16.	Net Worth (Total Equity excluding Non-controlling Interest)	1,78,676.86	1,70,443.43	1,76,714.98	1,78,676.86	1,76,714.98	1,86,487.32	1,76,311.38	1,83,416.27
17.	Outstanding Debt	1,34,465.54	1,31,479.52	1,16,495.74	1,34,465.54	1,16,495.74	1,42,559.90	1,42,082.27	1,23,453.57
18.	Debt Equity Ratio (Times)	0.75	0.77	0.66	0.75	0.66	0.75	0.66	0.75
19.	Earnings per Share (₹)	5.28	2.09	3.51	9.41	28.77	5.90	1.54	9.87
20.	Capital Redemption Reserve	-	-	-	-	0.42	0.42	0.42	0.42
21.	Bond Redemption Reserve	-	-	-	-	18.75	18.75	18.75	18.75
22.	Debt Service Coverage Ratio (Times)	1.06	1.08	1.19	1.07	2.17	0.94	1.04	1.30
23.	Interest Service Coverage Ratio (Times)	6.17	3.59	5.54	4.02	9.08	6.58	3.35	5.93

Notes:

1. The Board of Directors have recommended the final dividend of ₹3.00 per equity share (face value of ₹10/- per equity share) in this meeting for FY 2024-25 subject to approval by the members of the Company in the Annual General Meeting.
2. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 & Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange websites i.e. BSE Limited (www.bseindia.com) and NSE Limited (www.nseindia.com) and also on the company's website (www.iocl.com).

Place: New Delhi

Date: 30th April 2025

BY ORDER OF THE BOARD

sd/-

(ANUJ JAIN)

DIRECTOR (FINANCE)

DIN: 10310088

[web: www.iocl.com](http://www.iocl.com)Follow us on: [f](https://www.facebook.com/IndianOilCorporation) [t](https://www.twitter.com/IndianOilCorporation) [y](https://www.youtube.com/IndianOilCorporation) [i](https://www.instagram.com/IndianOilCorporation)**PRAJ INDUSTRIES LIMITED**

CIN - L27101PN1985PLC038031

Regd. Off. "PRAJ TOWER", S.NO. 274 & 275/2,
BHUMKAR CHOWK - HINJEWADI ROAD, HINJEWADI, PUNE - 411 057**EXTRACT OF STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH 2025.**

Sr. No.	Particulars	(Rupees in million except per share data)		
		Quarter ended 31 March 2025 (Audited)	Year ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2024 (Audited)
1.	Revenue from operations	8,596.809	32,280.422	10,185.646
2.	Net profit for the period (before tax and exceptional items)	582.519	2,703.963	1,230.237
3.	Net profit for the period (before tax and after exceptional items)	582.519	2,985.535	1,230.237
4.	Net profit for the period after tax	398.169	2,189.330	919.361
5.	Total comprehensive income for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	401.620	2,167.688	901.927
6.	Paid up equity share capital (Face value Rs.2/- each)	367.626	367.626	367.626
7.	Earnings per share (of Rs. 2/- each)			
1. Basic (not annualised)	2.17	11.91	5.00	
2. Diluted (not annualised)	2.17	11.91	5.00	

Notes:

1. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings on 28th April 2025 and 29th April 2025.
2. The Group operates only in one segment, i.e. "Process and Project Engineering".
3. Exceptional item consists of profit on sale of land located at Nasarapur, which was classified as "Asset held for sale" as of 31st March 2025.
4. Praj GenX Limited (GenX) commenced operations at its Mangalore facility in March 2024. For the financial year ended 31st March 2025, the reported profit before tax incorporates scale-up related expenditure totalling Rs 768.130 Mn. With requisite client approvals now secured, GenX is geared up to contribute to Group Revenue and PBT from FY 25-26.
5. On 28th March 2025, a fire broke out at R&D facility, Praj Matrix, causing a temporary disruption of R&D activities for a couple of weeks. The facility was fully insured, and a claim for the loss has already been lodged with the insurance company. The Management of the Group expects to recover the estimated losses, including damage to the property, and therefore, no provision for losses has been made in the current quarter's financial statements.
6. The Board of Directors proposed a final dividend of Rs 6 per equity share @ 300% of the face value of Rs 2 per equity share, for the financial year ended 31st March 2025, which is subject to the approval of shareholders at the forthcoming Annual General Meeting.
7. In December 2024, the Company has incorporated a new subsidiary in Tanzania, Praj Projects (Tanzania) Limited, to execute projects in the region. The subsidiary became operational in January 2025, and its financial results have been consolidated with the Company's financial statements for the quarter ending 31st March 2025.
8. The Standalone audited financial results for the quarter and Year ended on 31st March 2025 are summarized below:

Sr. No.	Particulars	(Rupees in million except per share data)		
		Quarter ended 31 March 2025 (Audited)	Year ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2024 (Audited)
a.	Revenue from operations	7,011.223	27,446.636	8,392.752
b.	Net profit for the period after tax	589.931	2,644.280	755.234
c.	Total comprehensive income for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	594.124	2,622.607	747.452
d.	Earnings per share (of Rs. 2/- each)			
1. Basic (not annualised)	3.21	14.39	4.11	
2. Diluted (not annualised)	3.21	14.39	4.11	

9. The above is an extract of the detailed format of Financial Results for the quarter and Year ended on 31st March 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and SEBI circular no. CIR/CFD/FAC/62/2016 dated 5th July 2016. The full format of the Financial Results is available on the Stock Exchange websites at www.nseindia.com and www.bseindia.com and on the Company's website at www.praj.net.
The same can be accessed by scanning the QR Code provided below.

Place : Pune
Date : 29 April 2025SHISHIR JOSHIPURA
CEO AND MANAGING DIRECTOR
DIN: 00574970**DELHI DEVELOPMENT AUTHORITY**

Fostering Public-Private Engagement for transforming Delhi

RFP for two 5 Star Hotel Projects in
Nehru Place, Delhi & Sector 23, Dwarka, Delhi

The Delhi Development Authority (DDA) intends to allot 2 land parcels on license fee basis, located in Plot No. A4, Nehru Place, South Delhi and Plot A, Sector 23, Dwarka, New Delhi for developing 5 Star Hotels.

The development control norms will be as per MPD 2021 and Unified Building Bye-Laws 2016. The Star Rating guidelines as per Ministry of Tourism shall be applicable.

The key dates of the RFP are as follows:

- Publication of RFP – 5 May, 2025
- Site Visit Dates – From 5 May, 2025 to 18 June, 2025
- Pre Bid Date and Time – 11:00 AM on 19 May, 2025
- Last Date of Submission of Queries – 20 May, 2025
- Bid Due Date and Time – 12:00 PM of 19 June, 2025

The RFP and the Licence Deed can be downloaded from:

<https://dda.gov.in/tenders>

Key Site Details:**Land Area**

2.256 Acre

(Nehru Place)

2.524 Acre (Dwarka)

Site Coordinates

Nehru Place:

28.5506639, 77.2546462

Dwarka:

28.5659332, 77.0404613

FAR

325 (Nehru Place)

375 (Dwarka)

Ground Coverage

50% (Nehru Place)

40% (Dwarka)

Land Status

Vacant

Mode of Allotment

License-fee basis

License Period

55 Years

For site visits, please contact:

Sh. Rahul Dev Samtayan (Dwarka) on +91 94318 90236

Sh. Rohit Kamawat (Nehru Place) on +91 97725 64535

For any queries, please contact:

Sh. Kunal Kashyap, Commissioner, DDA on +91 98362 50026

